

June 9, 2023

આષાઢ – કૃષ્ણ પક્ષ- ચઠ્ઠી
વિક્રમ સમ્વત ૨૦૮૦

National Stock Exchange of India Limited
"Exchange Plaza"
Bandra – Kurla Complex,
Bandra (E), Mumbai – 400 051
NSE Code: GHCL

BSE Limited
Corporate Relationship Department,
1st Floor, New Trading Ring, Rotunda
Building, P.J. Towers,
Dalal Street, Fort, Mumbai – 400 001
BSE Code: 500171

Dear Sir/Madam,

Sub: Filing of Published copy of Advertisement released for notice of 40th Annual General Meeting and Remote E-voting information.

In continuation to earlier communication dated May 30, 2023 and June 8, 2023 related to 40th AGM and pursuant to requirement of Listing Regulations read with other applicable provisions, if any, please find enclosed herewith copy of advertisement released in Business Line (English) dated June 9, 2023, The Economics Times (English) - Ahmedabad edition dated June 9, 2023 and Jai Hind (Gujarati) dated June 9, 2023.

Copy of this notice shall also be available on the website of BSE Limited (www.bseindia.com/corporates), National Stock Exchange of India Limited (www.nseindia.com/corporates) and on the website of the Company (<https://www.ghcl.co.in/statutory-communication>)

Thanking you

Yours faithfully

For **GHCL Limited**



Bhuneshwar Mishra
Vice President – Sustainability & Company Secretary

RBI brings UCBs under framework for compromise settlements, loan write-offs

CALMING THE STORM. Central bank also proposes loan restructuring for those affected by natural calamities

Anshika Kayastha
Mumbai

In order to provide an impetus to the prudential framework for resolution of stressed assets and to harmonise instructions across all regulated entities (REs), the RBI has issued a comprehensive regulatory framework governing compromise settlements and technical write-offs covering all REs.

NATURAL CALAMITIES
The central bank will also issue guidelines to rationalise the extant prudential norms for the implementation of resolution plans in respect of exposures affected by natural calamities, drawing upon lessons from the resolution frameworks introduced during the Covid pandemic. "It is proposed to issue comprehensive guidelines on compromise settlements and technical write-offs, which will now be applicable to all regulated entities, including co-operative banks. Further, it is also proposed to rationalise the extant prudential norms on restructuring of borrower accounts affected by natural calamities," said Governor Shaktikanta Das in his statement. The initiative is to rationalise the existing framework for compromise settlements because these instructions were issued across several circulars at different points



in time and are now being brought in one place, said Deputy Governor M Rajeshwar Rao. "A more significant factor is that this has been extended to urban co-operative banks also which was not there hitherto," he added. In its current form, the Prudential Framework for Resolution of Stressed Assets, dated June 2019, provides a broad principle-based framework. Compromise settlement is recognised as a resolution mechanism in respect of

non-performing assets under the framework, which is applicable to commercial banks and select NBFCs. "This will help expediting closure of settlement proposals under a certain regulatory framework, promising further cleansing of bank and corporate books, with renewed focus on further credit and business growth," said Soumitra Majumdar, Partner at corporate law firm JSA. Karthik Srinivasan, Senior Vice-President, Group Head, Financial Sector Ratings, ICRA, said the likely inclusion of non-banks in the framework can help improve their ability to resolve these assets and at a relatively lower haircut.

RBI allows FLDG arrangements, caps cover at 5% of loan portfolio

Anshika Kayastha
Mumbai

The RBI has permitted First Loss Default Guarantee (FLDG) arrangements between two regulated entities (REs), or between regulated entity and Lending Service Providers (LSPs) for digital lending. Arrangements involving default loss guarantee (DLG) will, hence, not be treated as 'synthetic securitisation', and will not attract the provisions of 'loan participation'. The guidelines are effective immediately. "REs shall ensure that total amount of DLG cover on any outstanding portfolio, which is specified upfront, shall not exceed 5 per cent of the amount of that loan portfolio," said the central bank, adding that even in the case of implicit

guarantee arrangements, the DLG provider will not bear performance risk of more than 5 per cent of the underlying portfolio. **NEED FOR FLDG**
The RBI has defined DLG as a contractual arrangement where the partner entity guarantees to compensate the RE for loss due to default up to a certain percentage of the loan portfolio. This includes other similar implicit guarantees linked to the performance of portfolios. As a part of the monetary policy on Thursday, the RBI announced allowing FLDG arrangements, with the objective of maintaining a balance between innovation and prudent risk management. The framework will facilitate orderly development of the digital lending ecosystem and enhance

credit penetration, it said. *Businessline* had, on May 29, reported that a framework will be issued shortly, and is likely to be more enabling than prohibitive. Digital lenders had presented to the regulator the urgency of the situation, and why allowing FLDG arrangements is crucial, given that the industry is pivoted around it and several companies have built their business models on it. "The RBI has been engaging with multiple stakeholders on DLG and has incorporated most of the feedback into consideration," said Jatinder Handoo, CEO of Digital Lenders Association of India (DLAI). He added that the guidelines leave limited room for ambiguity, and the well-defined structure will facilitate players to participate in an effective and transparent manner.

QUOTES.



RBI's communication was nuanced and tailored to anchor market expectations for the future in terms of a durable glide path of inflation. The policy changes on the development front covers a wide spectrum and prioritises resolution, risk management, and digital innovation

DINESH KHARA
Chairman, SBI



MPC's well-timed rate hikes earlier have allowed it the leeway to keep the repo rate unchanged at 6.5 per cent for the current cycle. Inflation, however, still remains a concern and is expected to remain above targeted levels right through FY24

MURALI RAMAKRISHNAN
MD and CEO, South Indian Bank



The RBI has not let the guard down on the inflation front. The decision to keep the signal rate unchanged is also to assess the fuller impact of the cumulative rate hike of 250 bps, which is still working its way to contain inflation within the comfort zone. RBI's projection on the growth front is quite optimistic

AK GOEL
Chairman, IBA

Banks can set own limits for borrowing in call and notice money markets: Das

Our Bureau
Mumbai

Scheduled commercial banks (excluding small finance banks) will be allowed to set their own limits for borrowing in call and notice money markets, according to the RBI. This will be within the prudential limits for inter-bank liabilities prescribed by the Reserve Bank of India. This is with a view to providing greater flexibility for managing money market borrowings, Governor Shaktikanta Das said



during his statement on RBI's monetary policy decision.

MORE FLEXIBILITY
The extant guidelines on the call, notice, and term

This is with a view to providing greater flexibility for managing money market borrowings, said RBI Governor

money markets prescribe prudential limits for outstanding borrowing in call and notice money markets for Scheduled commercial banks. Karthik Srinivasan,

Senior Vice-President, Group Head - Financial Sector Ratings, ICRA, observed that banks are already permitted to set their own limits for borrowing in term money and a similar proposal for call and notice money borrowings will allow more flexibility to banks. "With the current volatility in liquidity conditions, banks can plan liquidity management better and the LCR (liquidity coverage ratio) requirements will ensure that dependence on call borrowing is under check," he said.

'Our monetary policy actions are determined primarily by domestic conditions'

Anshika Kayastha
Mumbai

After announcing a pause in interest rates, RBI Governor Shaktikanta Das said future action will depend on the evolving situation. Although headline inflation has eased, there is no room for complacency.

He said the MPC remains resolutely focussed on a 4 per cent inflation target in the interest of sustainable growth. Das, along with senior officials of the central bank, responded to questions from the media. Excerpts:

There is greater willingness for VRRRs against repo auctions. Is the RBI more comfortable with a higher call rate?
Our target of monetary policy, 6.5 per cent, is the policy repo rate and typically our expectation is that, and what we would like to see is that the overnight call rates are also aligned to 6.5 per cent. Beyond that, it is a


function of day-to-day or week-to-week fluctuation in the overall liquidity situation; so we expect and we would like the overnight call rates to be aligned with 6.5 per cent policy rate. Whether there is a preference for VRRR or VRRRR, that depends on the prevailing situation in the market, and we will remain very nimble and flexible and act swiftly as we have done over the last four days. We will do two-sided operations according to the requirement. There is still some amount of liquidity sitting there, and when we say banks are cautious, let us remember that through the VRRRR auctions till yesterday, about 1.50 lakh crore has been mopped up through VRRRR operations.

Why are banks cautious because participation in VRRRs has been low? And does falling rates augur well for rate transmission?
Michael Patra: The reason for caution among banks is that there is an imminent

We do watch what other central banks are doing, because that will have an impact on the global financial situation

SHAKTIKANTA DAS
RBI, Governor

advanced tax outflow, which will happen next week. So they are holding back money for that purpose. But as you saw, we were persevering in our efforts. The fact that we repeated our auctions indicated our purpose, which is what we wanted to convey. It was important, therefore, to withdraw excess liquidity so that deposit and lending rate which were suffering become more aligned with the interest rate cycle. Shaktikanta Das: It is necessary that any segment of the market does not prematurely assume certain



things and then starts cutting rates on either asset or deposit side. I mean, as you know, both deposit rates as well as interest rates for loans are all deregulated. Banks are free to do it, but if they are doing it on the assumption of a certain action that is likely to be taken by the RBI, I think that would be wrong. Our liquidity action should also be seen in the context that our monetary policy stance and policy rates are well aligned with the interest rates, which are prevailing in the market.

When will the ECL norms be rolled out, and have banks expressed concerns over the deadline?

Das: If look at our track record, we give time for compliance. We will give them sufficient time for implementation of ECL norms. Whenever we issue new norms, we give time. There's no need to create any panic or anything; the comments have been received. As the Deputy Governor has pointed out, they are under examination and we will issue the circular, but we

are mindful of the fact that banks will need some time to implement it. We have assessed the additional capital requirements and it's quite manageable as per our assessment.

What will be impact of MSP hike on inflation, and has it been factored in the revised projection?
Michael Patra: We got the MSP data yesterday and we find that the average increase across all crops is about 7.5-8 per cent, so over and above our projections, this will impact to the extent of 10-12 bps.

Is there a level of real rate that will make it restrictive for the economy to keep growing? And is the RBI comfortable with a rising interest rate differential with the Fed?
Das: Our monetary policy actions are determined primarily by domestic conditions. We do not look at the action of other central banks to determine our actions, but yes, we do watch what other central banks are doing, because that will have an impact on the global financial situation, currency markets and other aspects.

Keeping an Arjuna eye on inflation

Hamsini Karthik
Mumbai

It was an almost given that the monetary policy committee's verdict would be to pause the repo rate. In fact, the Governor's speech on Thursday had no surprise elements, and that a good proposition, because it indicates that despite global headwinds and uncertainties, it's still peaceful back home.

ANALYSIS.

Keeping GDP expectations unchanged at 6.5 per cent while lowering inflation expectation to 5.1 per cent for FY24 are big positives and reiterate domestic resilience. Flows from abroad, whether into the equity markets or direct investments, have entered the green patches

after a long time, and that further cements the conviction around the country's medium-term outlook. Yet, despite these positives, it was a very measured commentary from the RBI Governor Shaktikanta Das, as inflation still behaves like an undisciplined child. "We need to maintain Arjuna eye on inflation," said Das. There are two ways to tame this child. Either calibrate the repo rate or curb liquidity. Presumably, with the 250 basis points rate hikes since May 2022, the first option has been almost fully explored for now. According to Das, it is starting to show the desired results. So now, the RBI has turned to liquidity management to keep inflation in check. The series of variable repo rate (VRR) and variable rate reverse repo (VRRRR) auctions in

recent months were measures adopted for this purpose. The interesting inference from these exercises was that banks would prefer to rely on the regulator for liquidity, but they don't want to park money with the RBI at this point. The regulator, on the other hand, wants banks to build their own liquidity channels (deposits mainly), and not rely much on the system for liquidity. This is an interesting tug of war. While the core inflation is within the 4-6 per cent comfort zone, real inflation breaches this range. For that to be in check, a combination of discretionary and non-discretionary spends need to be curbed. The composition of banks' loan growth suggests that a lot of short-term retail borrowing is helping the buoyancy of credit. For banks, this demand can be met through short-term li-

quidity; it doesn't have to rely on 2-3 years' deposits and so on. **DISCOMFORT OF RBI**
The regulator has been expressing its discomfort on the growing proportion of such short-term (often unsecured), and unless this trend starts to cool-off a bit, it could get difficult to keep a tab on real inflation. The question is how comfortable and for how long will the regulator support liquidity? Especially, if the money isn't getting utilised in creating assets or wealth. This explains why the Governor remained tightly focussed on inflation, more severely than his previous MPC speeches. Therefore, while a long pause on repo seems almost a given, the attention visibly shifts to liquidity. Will the ₹1.7-lakh crore of surplus be maintained?

GHCL Limited
 Regd. Off. : GHCL House, Opp. Punjabi Hall, Navrangpura, Ahmedabad-380009 (Gujarat)
 Email : ghclinfo@ghcl.co.in, secretarial@ghcl.co.in; Website : www.ghcl.co.in
 Phone : 079-26434100, Fax : 079-26423623 (CIN : L24100GJ1983PLC006513)

NOTICE OF 40TH ANNUAL GENERAL MEETING AND REMOTE E-VOTING INFORMATION

In continuation of our previous advertisement published on May 27, 2023, we hereby issue a NOTICE to inform you that the 40th Annual General Meeting (AGM) of our Company is scheduled to take place on **Saturday, July 1, 2023** (गुरुवार, अष्टाद, शुक्ल पक्ष - त्रयोदशी, विक्रम संवत् २०८०) at 10.00 a.m. (IST) via video conference & other audio visual means (VC).

In accordance with the circulars issued by the Ministry of Corporate Affairs (MCA) and the Securities and Exchange Board of India (SEBI), companies are permitted to conduct AGMs through VC / OAVM without the physical presence of members at a common venue. Therefore, our Company has opted to hold the AGM via VC to discuss and transact the business outlined in the Notice of AGM dated April 29, 2023.

In compliance with the circulars, we have electronically sent the notice of the 40th AGM and the Integrated Annual Report of our Company for the financial year 2022-23 to all members whose email addresses are registered with the Company or Depository Participants. These documents are also accessible on our company's website (www.ghcl.co.in), as well as on the websites of BSE Limited (www.bseindia.com), National Stock Exchange of India Limited (www.nseindia.com), and CDSL (www.evotingindia.com). The dispatch of the AGM notice via email was completed on **June 8, 2023**.

As per the cut-off date, which is **June 24, 2023 (Saturday)**, the voting rights of members will be determined based on their shares of the paid-up equity share capital of the Company. To facilitate the voting process, Central Depository Services Limited (CDSL) will provide the option for members to cast their votes through an electronic voting system, known as "remote e-voting." The Notice of the AGM includes information on the process and procedure for remote e-voting, as well as instructions for participating in the AGM through video conference.

The remote e-voting period for the 40th AGM will commence on **Monday, June 26, 2023, at 9:00 a.m. IST** and conclude on **Friday, June 30, 2023, at 5:00 p.m. IST**. During this period, members of the Company may electronically cast their votes on the agenda items specified in the Notice. The e-voting module will be disabled after the voting period ends, and no further changes to the cast votes will be allowed.

Additionally, members attending the meeting will have the option to vote through the electronic voting system during the AGM. Those who have already cast their votes through remote e-voting will be able to attend the meeting but will not be eligible to vote again. Detailed instructions for members regarding remote e-voting were provided in the AGM Notice and the newspaper advertisement published on **May 27, 2023**.

If you have any queries or issues regarding e-voting, we have provided resources to assist you. You can refer to the Frequently Asked Questions (FAQs) and e-voting manual available at www.evotingindia.com under the help section. Additionally, you can reach out for support by sending an email to helpdesk.evoting@cdslindia.com or by calling 1800225533. Alternatively, you may contact the concerned employees of CDSL at 022-23058543 / 23058542 between 10:00 a.m. to 6:30 p.m. from Monday to Friday.

For any grievances related to electronic voting, you can contact Mr. Ganapati Haligouda at mt.helpdesk@linkintime.co.in or reach out to Link Intime India Pvt. Ltd. at the following address : C-101, 247 Park, L. B. S. Marg, Vikhroli (West), Mumbai-400083, Tel: 022-49186000.

We kindly request that you send your queries at least seven days in advance of the meeting to ensure that the information can be made available and addressed during the meeting.

Your engagement and participation are highly valued, and we are here to provide assistance and support throughout the e-voting process.

For GHCL Limited
Bhuvneshwar Mishra
 Vice President - Sustainability & Company Secretary

Place : Noida
 Date : June 8, 2023

દેશની મધ્યસ્થ બેન્ક માટે પણ સોનુ 'સલામત' રોકાણ


રીઝર્વ બેન્ક પાસે પાંચ વર્ષમાં સોનાનો સ્ટોક ૪૦% વધ્યો

મુંબઈ: સોની સલામત રોકાણ માટે સોનુ ભારતના ઘરેથી રીઝર્વ બેન્કના સેઈફ ડિપોઝીટ વોલ્ટમાં સ્થાન મેળવે છે અને સોનાની કિંમત ઉંચી જાય તો પણ તેની ઈનવેસ્ટમેન્ટ વેલ્યુ ઘટતી નથી તેનું સોની મોટું કારણ તે રોકાણનું બેખબર લગભગ 'નીલ' કરે છે તે છે અને રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પણ અમેરિકી ફાગવતી સ્થિતિ ડોલરની વધતી જતી કિંમતમાં રૂપિયામાં થતા ધસારા સામે 'હેજ' ફેક્ટર તરીકે પણ સોનાની ખરીદી વધારી રહી છે અને છેલ્લા પાંચ વર્ષમાં રીઝર્વ બેન્કના સોનાના સ્ટોકમાં ૪૦% જેવો વધો થયો છે. આંતરરાષ્ટ્રીય કરન્સીમાં રીઝર્વ બેન્ક પાસે અમેરિકી ડોલર સોથી વધુ માત્રામાં રહે છે જે આંતરરાષ્ટ્રીય ચલણનું સ્થાન ધરાવે છે તો બીજા તરફ કુવાવા સામે પણ આરબીઆઈને તેના રોકાણને ઓછામાં ઓછા ધસારો અનુભવવો પડે તે જોવું જરૂરી બની ગયું છે અને ડોલર પરની નિર્ભરતા ઘટાડવામાં પણ સોનુ શ્રેષ્ઠ વિકલ્પ છે. રીઝર્વ બેન્ક પાસે ડિસેમ્બર ૨૦૧૭માં મિલિયન ટ્રોપ ઓસ સોનુ હતું. (૧ ટ્રોપ ઓસ એવો ૩૫ ગ્રામથી થોડું વધુ કિમતી ધાતુ સોનુ-૧૧૨૧.૫૬૬૬ ગ્રામ-૧૧૨૧.૫૬૬૬ ગ્રામ માટે આ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. જે ચાલુ વર્ષે એપ્રિલમાં વધીને ૨૫.૫૫ મીલીન ટ્રોપ ઓસ પહોંચી ગયું છે. આમ અંદાજીત ૭૮૫ ટનનો સોનાનો જથ્થો વધ્યો છે. આમ ફક્ત ભારત જ નહીં પણ વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો તેના

સોનાના ભંડાર વધારી રહી છે. ફક્ત જાન્યુઆરી માસમાં જ દુનિયાની તમામ સેન્ટ્રલ બેન્કોએ એક માસમાં ૨૮૮ ટન સોનુ ખરીદ્યું હતું અને ખાસ કરીને કોરોના પછીના સમયમાં જે અનિશ્ચિતતાની સ્થિતિ છે તેમાં આ ચલણ મજબૂત બન્યું છે.

રીઝર્વ બેન્ક દ્વારા તેના સોનાના ભંડારમાં વધારા માટે એક અન્ય કારણ પણ છે તે તેના રીઝર્વને વૈવિધ્યસભર બનાવે છે જેની કોવિડ કે તેવી મહામારી સમયે તેના રીઝર્વ પરનું 'બેખબર' સોથી ખોજી છે તેથી જ દેશના વિદેશી સ્ટોક યી ધટીને ૮% સુધી થયું છે. ઉપરાંત તે કુવાવા સામે પણ રક્ષણ આપે છે. ચલણની કિંમતમાં ધસારાની અસરને ઘટાડવામાં મદદ કરે છે. કોઈ અન્ય વૈવિધ્યક કરન્સીની વિશ્વસનીયતાના અભાવે ડોલર દુનિયા પર રાજ કરે છે છતાં તે પરિસ્થિતિ કાયમી રહે તેવું પણ નથી. એક તરફ સોનાના ભાવ વધવાથી તેની રીટર્ન ખરીદી ઘટી હતી તો રીઝર્વ બેન્કની ખરીદી વધી હતી. રીઝર્વ બેન્ક પાસે હાલ ૭૮૪.૬૪ ટન સોનાના ભંડાર છે જેમાં ૫૬.૩૨ ટન ગોલ્ડ ડિપોઝીટ સ્કીમનો જથ્થો છે. ૪૩૭.૩૨ ટન ગોલ્ડ વિદેશમાં સેઈફ કર્ડરમાં છે જ્યારે ૩૦૧.૧૦ ટન ભારતીય છે. ભારતનું સોનુ મુખ્યત્વે બેન્ક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ ઈસ્ટ-ઈસ્ટનેશનલ મેટેલબેન્ક આપે છે.

કુવાવા સામે રક્ષણ ઉપરાંત ડોલર પરની નિર્ભરતા ઘટાડવાનો વ્યુહ: આરબીઆઈ પાસે ૭૮૫ ટન સોનુ જેમાં ૪૩૭.૩૨ વિદેશમાં 'સેઈફ કર્ડર'માં રખાયું છે



બિહારના રોહતાસમાં સોન નદી પર બનેલા પુલના બે પિલર વચ્ચે ગઈકાલથી રંજનકુમાર નામનો ૧૧ વર્ષનો કિશોર ફસાયેલો છે તેને છલ્લા ૨૪ કલાકથી વાંસની મદદથી ખોરાક અને પાઈપ દ્વારા ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે. આ કિશોરને સુરક્ષિત બહાર કાઢવા માટે એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવેલું નજરે પડે છે.

લગ્નનો વીડિયો યોગ્ય રીતે ન બનાવનારા ફોટગ્રાફરને ૨૫૦૦૦નો દંડ ચૂકવવા નિર્દેશ

બેંગલુરુ, તા.૮: ફોટા મોકલ્યા વિના ગાયબ થઈ મૅટ પૂછતો હતો, ફોટોગ્રાફરે કથિત રીતે તેને માર્ચ ૨૦૨૦ સુધી કેટલાક સેમ્પલ મોકલ્યા હતા. મહિનાઓ સુધી ફોટોગ્રાફરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યા પછી, આખરે જાન્યુઆરી ૨૦૨૧માં યુવકને કહેવામાં આવ્યું કે મુલૂતની વીડિયો ગુમ છે અને ફોટોગ્રાફર ભૂલની ભરપાઈ કરવા તૈયાર છે.

બેંગલુરુના એક ફોટોગ્રાફરને બેદરકારી મોંઘી પડી

બેંગલુરુ, તા.૮: ફોટા મોકલ્યા વિના ગાયબ થઈ મૅટ પૂછતો હતો, ફોટોગ્રાફરે કથિત રીતે તેને માર્ચ ૨૦૨૦ સુધી કેટલાક સેમ્પલ મોકલ્યા હતા. મહિનાઓ સુધી ફોટોગ્રાફરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યા પછી, આખરે જાન્યુઆરી ૨૦૨૧માં યુવકને કહેવામાં આવ્યું કે મુલૂતની વીડિયો ગુમ છે અને ફોટોગ્રાફર ભૂલની ભરપાઈ કરવા તૈયાર છે.

KALPANA-TRAFU
KALPATARU PROJECTS INTERNATIONAL LIMITED
(Formerly Kalpataru Power Transmission Limited)

કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઈન્ટરનેશનલ લિમિટેડ
(અગાઉની કલ્પતરુ પાવર ટ્રાન્સમિશન લિમિટેડ)
રજિ. ઓફિસ: પ્લોટ નં.૧૦૧, પાર્ટ-III, જીઆઈડીસી એસ્ટેટ, સેક્ટર-૨૮, ગાંધીનગર - ૩૮૨ ૦૨૮, ગુજરાત, ભારત
ટેલિ.નં: +૯૧ ૭૯ ૨૩૨ ૧ ૪૦૦૦ CIN:L40100GJ1981PLC004281
ઈમેલ: cs@kalpatarupower.com વેબસાઈટ: www.kalpatarupower.com

કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઈન્ટરનેશનલ લિમિટેડ
(અગાઉની કલ્પતરુ પાવર ટ્રાન્સમિશન લિમિટેડ)
રજિ. ઓફિસ: પ્લોટ નં.૧૦૧, પાર્ટ-III, જીઆઈડીસી એસ્ટેટ, સેક્ટર-૨૮, ગાંધીનગર - ૩૮૨ ૦૨૮, ગુજરાત, ભારત
ટેલિ.નં: +૯૧ ૭૯ ૨૩૨ ૧ ૪૦૦૦ CIN:L40100GJ1981PLC004281
ઈમેલ: cs@kalpatarupower.com વેબસાઈટ: www.kalpatarupower.com

કેન્દ્રના નવ વર્ષની સિદ્ધિઓની પ્રધાને માહિતી આપી દેશમાં ૫ વર્ષમાં ૨૦૦થી વધુ એરપોર્ટ, હેલિપોર્ટ અને સી પ્લેન હશે : સિંધિયા

નવી દિલ્હી, તા.૮: નાગરિક ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ ગઈકાલે જણાવ્યું હતું કે ભારતમાં આગામી પાંચ વર્ષમાં ૨૦૦થી વધુ એરપોર્ટ, હેલિપોર્ટ અને સી પ્લેન હશે અને ભારતીય એરલાઈન્સ આ સમયગાળા દરમિયાન ૧,૪૦૦થી વધુ વધારાના એરક્રાફ્ટનો ઓર્ડર આપશે. કેન્દ્ર સરકારના નવ વર્ષના કાર્યકાળમાં ઉડ્ડયન ક્ષેત્રમાં થયેલા કામોની માહિતી આપવા માટે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં સિંધિયાએ કહ્યું હતું કે ભારતમાં ૨૦૧૪ સુધી ૭૪ એરપોર્ટ હતા અને હવે આ સંખ્યા વધીને ૧૪૮ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે ભારતમાં ૨૦૧૩-૧૪માં ૭ કરોડ સ્થાનિક હવાઈ મુસાફરો હતા. હવે આ સંખ્યા ૧૩૫ ટકા વધીને ૧૪.૫ કરોડ થઈ ગઈ છે. તેવી જ રીતે આ સમયગાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરોની સંખ્યા ૫૦ ટકા વધીને ૪.૭ કરોડ થઈ ગઈ છે. સિંધિયાએ આ અંગેની વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આ સિવાય સ્થાનિક આંતરરાષ્ટ્રીય બંને ફ્લાઈટમાં માલસામાનો

રૂ. ૨૦૦૦ની ૫૦% નોટો બેન્કોમાં પરત

નવી દિલ્હી: રૂ. ૨૦૦૦ની ચલણી નોટો પરત ખેંચવાની જાહેરાતના પ્રથમ પગલાવડીયામાં આ ચલણની ૫૦% નોટો બેન્કોમાં જમા એકસચેંજ થઈ ગઈ છે. આજે રીઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે મોન્ટેટરી પોલીસીની જાહેરાત કરતા સમયે જણાવ્યું કે રૂ. ૨૦૦૦ના ચલણી રૂ. ૧.૮૦ લાખ કરોડની નોટો બેન્કોમાં જમા થઈ ગઈ છે. ગત મહિને રૂ. ૨૦૦૦ની ચલણી નોટો પરત ખેંચવાની રીઝર્વ બેન્કની જાહેરાત સમયે સીસ્ટમમાં કુલ રૂ. ૩.૨૬ લાખ કરોડની નોટો સીસ્ટમમાં હતી જે બેન્કોમાં જમા કરાવવા કે મર્યાદિત રીતે એકસચેંજ કરવા ના ૩૦ સપ્ટે. ૨૦૨૩ની ડેડલાઈન આપવામાં આવી છે. શ્રી

YES BANK
સુવર્ણ બેંકિંગ: પાલ ટાવર, ઓફિસ બેંકિંગ ઘર, સાંભુક ઈસ્ટ, મુંબઈ - ૪૦૦૦૫૫. સ્થાન: શાંતી માર્ગ, ટાઈમ સર્વિસ ગ્રાઉન્ડ, સિંધુ બેનક બ્લોક, બેંકોફ, અમદાવાદ-૩૮૦૦૫૯.

પ્રવેશન નોટીસ (આવક મિલકત માટે)
આપી, તા.૦૯.૦૬.૨૦૨૩ ના રોજ શ્રી ઈન્ડિયા ટેલિવિઝન લિમિટેડને સિદ્ધિઓના એન ઈન્વેસ્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ એન્ડોર્સમેન્ટ ઓફ સિદ્ધિઓ ઈન્વેસ્ટમેન્ટ, ૨૦૨૨ (૫૪ ઓગ ૨૦૨૨) તથા નવમ ૧૩(૧૩) ડેલિવ મેમોરી સતા સાથે સિદ્ધિઓ ઈન્વેસ્ટમેન્ટ (એન્ડોર્સમેન્ટ) નિયમો, ૨૦૨૨ તથા નિયમ ૧ અને ૨. ૨૮.૦૩.૨૦૨૩ ના રોજ ઉપરનાનો (૧), ૩. સર્વિસ ટ્રસ્ટ, ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ઈન્વેસ્ટમેન્ટ, ૨. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૩. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૪. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૫. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૬. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૭. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૮. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૯. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૦. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૧. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૨. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૩. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૪. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૫. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૬. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૭. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૮. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૯. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૦. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૧. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૨. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૩. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૪. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૫. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૬. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૭. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૮. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૯. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૩૦. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૩૧. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૩૨. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૩૩. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૩૪. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૩૫. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૩૬. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૩૭. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૩૮. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૩૯. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૪૦. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૪૧. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૪૨. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૪૩. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૪૪. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૪૫. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૪૬. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૪૭. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૪૮. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૪૯. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૫૦. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૫૧. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૫૨. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૫૩. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૫૪. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૫૫. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૫૬. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૫૭. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૫૮. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૫૯. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૬૦. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૬૧. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૬૨. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૬૩. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૬૪. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૬૫. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૬૬. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૬૭. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૬૮. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૬૯. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૭૦. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૭૧. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૭૨. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૭૩. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૭૪. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૭૫. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૭૬. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૭૭. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૭૮. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૭૯. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૮૦. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૮૧. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૮૨. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૮૩. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૮૪. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૮૫. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૮૬. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૮૭. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૮૮. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૮૯. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૯૦. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૯૧. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૯૨. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૯૩. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૯૪. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૯૫. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૯૬. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૯૭. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૯૮. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૯૯. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૦૦. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૦૧. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૦૨. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૦૩. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૦૪. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૦૫. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૦૬. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૦૭. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૦૮. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૦૯. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૧૦. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૧૧. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૧૨. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૧૩. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૧૪. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૧૫. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૧૬. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૧૭. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૧૮. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૧૯. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૨૦. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૨૧. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૨૨. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૨૩. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૨૪. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૨૫. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૨૬. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૨૭. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૨૮. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૨૯. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૩૦. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૩૧. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૩૨. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૩૩. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૩૪. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૩૫. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૩૬. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૩૭. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૩૮. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૩૯. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૪૦. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૪૧. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૪૨. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૪૩. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૪૪. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૪૫. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૪૬. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૪૭. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૪૮. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૪૯. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૫૦. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૫૧. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૫૨. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૫૩. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૫૪. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૫૫. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૫૬. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૫૭. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૫૮. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૫૯. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૬૦. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૬૧. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૬૨. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૬૩. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૬૪. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૬૫. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૬૬. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૬૭. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૬૮. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૬૯. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૭૦. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૭૧. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૭૨. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૭૩. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૭૪. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૭૫. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૭૬. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૭૭. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૭૮. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૭૯. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૮૦. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૮૧. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૮૨. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૮૩. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૮૪. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૮૫. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૮૬. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૮૭. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૮૮. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૮૯. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૯૦. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૯૧. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૯૨. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૯૩. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૯૪. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૯૫. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૯૬. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૯૭. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૯૮. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૧૯૯. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૦૦. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૦૧. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૦૨. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૦૩. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૦૪. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૦૫. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૦૬. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૦૭. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૦૮. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૦૯. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૧૦. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૧૧. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૧૨. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૧૩. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૧૪. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૧૫. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૧૬. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૧૭. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૧૮. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૧૯. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૨૦. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૨૧. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૨૨. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૨૩. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૨૪. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૨૫. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૨૬. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૨૭. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૨૮. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૨૯. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૩૦. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૩૧. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૩૨. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૩૩. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૩૪. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૩૫. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૩૬. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૩૭. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૩૮. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૩૯. સર્વિસ ટ્રસ્ટ, ઓફિસ બેંકિંગ, ૨૪૦. સર્